

મોડ્યુલ - 3

ભૂમિતી



નોંધ

18

રચનાઓ

પરિચય

ભૂમિતિ શીખવાનો એક હેતુ એ ચોકસાઈપૂર્વક આકૃતિઓ દોરવાનું કેશાલ્ય પ્રાપ્ત કરવું તે છે. ભૌમિતિક આકૃતિઓ જેવી કે ત્રિકોણ, ચોરસ અને વર્તુળ સીધી અને પરિકરની સહાયથી કેવી રીતે રચવી તે તમે શાખી ગયા છો. તમે $30^\circ, 90^\circ, 120^\circ$ અને 45° ના ખૂણા રચ્યા છો. વળી, તમે રેખાખંડનો લંબાદ્વિભાજક તેમજ કોણદ્વિભાજક દોર્યે છો.

આ પાઠમાં કેટલીક મહત્વની ભૌમિતિક રચવાનું શીખીશું.



હેતુઓ

આ પાઠ શીખ્યા પદ્ધતિ, અધ્યેતા :

- રેખાખંડને આંતરિક રીતે આપેલ પ્રમાણમાં વિભાગી શકશે.
- આપેલ ડેટા (વિગત) પરથી ત્રિકોણ રચી શકશે છ
 - (1) બાબાબા
 - (2) બાઘુબા
 - (3) ખૂબાખૂ
 - (4) કાકબા
- (5) પરિમિતિ અને પાયાના કોણ
- (6) પાયો (આધાર), અન્ય બે બાજુઓનો સરવાળો / તર્ફાવત અને એક આધાર કોણ
- (7) બે બાજુઓ અને આ બાજુઓ પૈકીની એકને અનુરૂપ મધ્યગા
- આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ રચી શકશે.
- વર્તુળના કેન્દ્રનો ઉપયોગ કરીને,
 - (1) તેના બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક રચી શકશે.
 - (2) તેની ઉપરના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક રચી શકશે.

અપેક્ષિત પૂર્વજ્ઞાન

આપણે એવું માની લઈએ કે અધ્યેતા નીચેની રચનાઓ કરવા પરિકર અને સીધી પડ્હીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો છો :



રચનાઓ

- $30^\circ, 45^\circ, 60^\circ, 90^\circ, 105^\circ, 120^\circ$ ના ઘૂણા
- રેખાખંડનો લંબાક્રિબાજક
- આપેલ કોણનો દ્વિબાજક

18.1 રેખાખંડનું આપેલ પ્રમાણમાં આંતરિક રીતે વિભાજન


રચના -1 : રેખાખંડ AB આપેલ છે. તમારે તેને આંતરિક 2 : 3 પ્રમાણમાં વિભાગવાનો છે. આપણે નીચેનાં સોપાનો અનુસરીએ :

સોપાન-1 : AB સાથે લંબુકોણ રચતુ AC કિરણ દોરો.

સોપાન-2 : A થી શરૂ કરીને, બિંદુ A થી સમાન અંતરે 5 બિંદુઓ C_1, C_2, C_3, C_4 અને C_5 અંકિત કરો.

સોપાન-3 : C_5 અને B જોડો.

સોપાન-4 : C_2 (અર્થાત് બીજા બિંદુ) માંથી C_5B ને સમાંતર C_2D દોરો, જે AB ને D માં મળે.



આકૃતિ 18.1

અટલે આકૃતિ 18.1 માં દર્શાવ્યા મુજબ, D એ આવશ્યક બિંદુ છે જે AB ને આંતરિક રીતે 2 : 3 પ્રમાણમાં વિભાગે છે.



તમારી પ્રગતિ ચકાશો 18.1

1. 7 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. તેને આંતરિક રીતે 3 : 4 પ્રમાણમાં વિભાગો. દરેક ભાગ માપો. વળી રચનાનાં સોપાનો લખો.
2. રેખાખંડ $PQ = 8$ સેમી દોરો. તે પર બિંદુ R અનું શોધો કે $PR = \frac{3}{4} PQ$
(સંકેત : રેખાખંડ PQ ને આંતરિક રીતે 3 : 1 પ્રમાણમાં વિભાગો.)

મોડ્યુલ - 3

ભૂમિતી



નોંધ

રચનાઓ

18.2 ત્રિકોણ - રચના

રચના - 2 : ત્રણ બાજુઓ આપેલ હોય ત્યારે ત્રિકોણ રચવો. (બાબાબા)

ધારો કે તમારે ΔABC રચવાનો છે જેમાં $AB = 6$ સેમી, $AC = 4.8$ સેમી અને $BC = 5$ સેમી આપુણે નીચેનાં સોપાનો અનુસરીએ :


સોપાન - 1 : $AB = 6$ સેમી દોરો.

સોપાન 2: કેન્દ્ર A અને ત્રિજ્યા 4.8 સેમી લઈ ચાપ દોરો

સોપાન 3: કેન્દ્ર B અને ત્રિજ્યા 5 સેમી લઈ બીજું ચાપ દોરો. જે સોપાન 2 ના ચાપને C માં છેદ.

સોપાન 4: AC અને BC જોડો.

આમ, ΔABC એ આવશ્યક ત્રિકોણ છે.



આંકૃતિ ૧૮.૨

નોંધ : તમે BC કે AC ને આધાર લઈ શકો છો.

રચના 3: બે બાજુઓ અને અંતર્ગત કોણ આપેલ હોય ત્યારે ત્રિકોણ રચવો. (બાખુબા)

ધારો કે તમારે ત્રિકોણ PQR રચવો છે, જેમાં $PQ = 5.6$ સેમી, $QR = 4.5$ સેમી અને -- $\angle PQR = 60^\circ$ ત્રિકોણ રચવા માટે આપુણે નીચેનાં સોપાનો અનુસરીએ :


સોપાન 1: $PQ = 5.6$ સેમી દોરો.

સોપાન 2: Q આગળ -- $PQX = 60^\circ$ રચો.

સોપાન 3: કેન્દ્ર Q અને ત્રિજ્યા 4.5 સેમી લઈ QX ને R માં છેદતું ચાપ દોરો.

સોપાન 4: PR જોડો.

આટલે -- PQR એ આવશ્યક ત્રિકોણ છે.



આંકૃતિ ૧૮.૩

(નોંધ : તમે PQ ને બદલે QR = 4.5 સેમીને આધાર તરીકે લઈ શકો.)

રચના 4: જ્યારે બે ખૂણા અને અંતર્ગત બાજુ આપેલ હોય, ત્યારે ત્રિકોણ રચવો. (ખૂબાખૂ) ચાલો, આપુણે ΔABC રચીએ, જેમાં $\angle B = 60^\circ$, $\angle C = 45^\circ$, અને $BC = 4.7$ સેમી ત્રિકોણ રચવા આપુણે સોપાન અનુસરીએ :

સોપાન 1: $BC = 4.7$ સેમી દોરો

સોપાન 2: B આગળ, $\angle CBQ = 60^\circ$ રચો.

સોપાન 3: C આગળ $\angle BCQ = 45^\circ$ રચો, જે A આગળ BQ ને મળો.

આમ, ΔABC એ આવશ્યક ત્રિકોણ છે.

મોડચુલ - 3


ભૂમિતી



નોંધ

રચનાઓ

નોંધ : જ્યારે બે ખૂણા એક (અંતર્ગત બાજુ સિવાયની) કોઈ બાજુ આપેલ હોય, ત્યારે આપણે (ત્રિકોણના કોણના સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરીએ) ત્રીજો કોણ શોધીએ છીએ અને પછી ત્રિકોણ રચવા ઉપરની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ.



આકૃતિ ૧૮.૪

રચના ૫: જ્યારે કષ્ણ અને એક બાજુ આપેલ હોય, ત્યારે કાટકોણ ત્રિકોણ રચવો.

ચાલો, આપણે કાટકોણ ત્રિકોણ ABC રચીએ, જેમાં કાટખૂાં B આગળ,

બાજુ BC = 3 સેમી અને કરણ AC = 5 સેમી

ત્રિકોણ રચવા આપણે નીચેનાં સોપાનો અનુસરીએ :

સોપાન ૧: BC = 3 સેમી દોરો

સોપાન ૨: B આગળ, $\angle CBP = 90^\circ$ રચો.

સોપાન ૩: C કેન્દ્ર લઈ અને 5 સેમી ત્રિજ્યા લઈ BP ને A માં કાપતું ચાપ દોરો.

સોપાન ૪: AC જોડો.

$\triangle ABC$ એ આવશ્યક ત્રિકોણ છે.

રચના ૬: જ્યારે પરિમીતિ અને બે આધાર કોણ આપેલ હોય ત્યારે ત્રિકોણ રચવો.

ધારો કે આપણે એવો ત્રિકોણ રચવો છે જેની પરિમીતિ 9.5 સેમી અને આધાર ખૂણા 60° અને 45° હોય. ત્રિકોણ રચવા, નીચાનાં સોપાનો અનુસરીએ :

સોપાન ૧: XY = 9.5 સેમી દોરો.


સોપાન ૨: X આગળ $\angle YXP = 30^\circ$ રચો. (જે -- છે.)

સોપાન ૩: Y આગળ $\angle XYQ = 45^\circ$ રચો. (જે -- છે.)

XP અને YQ, A આગળ છેદે.

સોપાન ૪: XA નો લંબ દ્વિભાજક દોરો, જે XY ને B માં છેદે.

સોપાન ૫: YA નો લંબ દ્વિભાજક દોરો, જે XY ને C માં છેદે.



આકૃતિ ૧૮.૫

મોડયુલ - 3


ભૂમિતી



ੴ

રચનાઓ

સોપાન 6:



આકૃતિ. 18.6

AB અને AC જોડો.

ΔABC એ આવશ્યક ત્રિકોણ છે.

રચના 7: જ્યારે બે બાજુઓનો સરવાળો , તીજુ બાજુ અને ટ્રિક્ષણની તીજુ બાજુ પરનો કોઈ ખૂલ્લો આપેલ હોય, ત્યારે ટ્રિકોણ રચવો.


ધારો કે તમારે ટ્રિકોણ ABC રચવાનો છો.

જ્યારે $AB + AC = 8.2 \text{ cm}$, $BC = 3.6 \text{ cm}$ અને $\angle B = 45^\circ$

ત્રિકોણ રચવા આપણે નીચેના સોપાનો અનુસરીએ.

સોપાન 1: $BC = 3.6$ સેમી દોરો.

સોપાન 2:B આગળ $\angle CBK = 45^\circ$ રચો



આકૃતિ. 18.7

સોપાન 3: BK માંથી BP = 8.2 સેમી કાપો.

મોડચુલ - 3

ભૂમિતી



નોંધ

રચનાઓ

સોપાન 4: CP જોડો

સોપાન 5: CP નો લંબ દ્વિભાજ દોરો, જે BP ને A છેદ.

સોપાન 6: AC જોડો.

$\triangle ABC$ એ આવશ્યક ત્રિકોણ છે.

રચના 8: જ્યારે બે બાજુઓનો તફાવત, ત્રીજી બાજુ અને ત્રીજી બાજુ પરનો એક ખૂણો આપેલ હોય, ત્યારે ત્રિકોણ રચવો.

ધારો કે આપણે $\triangle ABC$ રચવો છે. જેમાં $BC = 4$ સેમી, $\angle B = 60^\circ$, $AB - AC = 12$ સેમી ત્રિકોણ રચવા માટે આપણે નીચેના સોપાનો અનુસરીએ.

સોપાન 1: $BC = 4$ સેમી દોરો.

સોપાન 2: $\angle CBP = 60^\circ$ રચો.

સોપાન 3: BP માંથી $BK = 1.2$ સેમી કાપો.

સોપાન 4: CK જોડો.

સોપાન 5: CK નો લંબ દ્વિભાજક દોરો, જે

લંબાવેલ BP ને A આગળ મળો છે.

સોપાન 6: AC જોડો.

$\triangle ABC$ એ આવશ્યક ત્રિકોણ છે.

રચના 9: જ્યારે બે બાજુઓ અને તે પૈકીની એક બાજુને અનુરૂપ મધ્યગા આપેલ હોય, ત્યારે ત્રિકોણ રચવો. ધારો કે તમારે $\triangle ABC$ રચવો છે, જેમાં $AB = 6$ સેમી, $BC = 4$ સેમી, અને મધ્યગા $CD = 3.5$ સેમી છે.

આપણે નીચેનાં સોપાનો અનુસરીએ :

સોપાન 1: $AB = 6$ સેમી દોરો.


સોપાન 2: AB નો લંબ દ્વિભાજ દોરો, જે AB ને D માં મળો.

સોપાન 3: D કેન્દ્ર લઈ ત્રિજ્યા 3.5 સેમી લઈ એક ચાપ દોરો.


સોપાન 4: B કેન્દ્ર લઈ અને ત્રિજ્યા 4 સેમી લઈ બીજુ ચાપ દોરો, જે સોપાન - 3 ના ચાપને C માં છેડે છે.

સોપાન 5: AC અને BC જોડો.

આમ, $\triangle ABC$ એ આવશ્યક ત્રિકોણ છે.



આકૃતિ 18.8



આકૃતિ 18.9

મોડ્યુલ - 3

ભૂમિતી



નોંધ

રચનાઓ



તમારી પ્રગતિ ચકાસો 18.2

1. ΔDEF રચો, આપેલ છે કે $DE = 5.1$ સેમી, $EF = 4$ સેમી અને $DF = 5.6$ સેમી રચનાનાં સોપાનો પણ લખો.
નોંધ : તમારે બાકીના દરેક ફૂટપ્રશ્નોમાં રચનાનાં સોપાનો લખવાનાં છે.
2. ΔPQR રચો, આપેલ છે કે $PR = 6.5$ સેમી, $\angle P = 120^\circ$ અને $PQ = 5.2$ સેમી
3. ΔABC રચો, આપેલ છે કે $BC = 5.5$ સેમી, $\angle B = 75^\circ$ અને $\angle C = 45^\circ$.
4. કાટકોણ ત્રિકોણ રચો, જેમાં એક બાજુ 3 સેમી અને કર્ણ 7.5 સેમી હોય.
5. કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોમ રચો જેમાં બાજુમાંની એક બાજુ 4.8 સેમી છે.
6. ΔABC રચો, આપેલ છે કે $AB + BC + AC = 10$ સેમી, $\angle B = 60^\circ$, $\angle C = 30^\circ$.
7. ΔABC રચો, જેમાં $AB = 5$ સેમી, $\angle A = 60^\circ$, $BC + AC = 9.8$ સેમી
8. ΔLMN રચો, જેમાં $\angle M = 30^\circ$, $MN = 5$ સેમી અને $LM - LN = 1.5$ સેમી
9. ત્રિકોણ PQR રચો, જેમાં $PQ = 5$ સેમી, $QR = 4.2$ સેમી અને મધ્યગાળા $RS = 3.8$ સેમી

18.3 આપેલ માપ પ્રમાણે આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના :

આપેલ માપ પ્રમાણે આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના (બાજુઓના આપેલા ગુણોત્તર પ્રમાણે આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ રચવો)

રચના : 10 ΔABC ને સમરૂપ હોય તેવા ત્રિકોણની રચના કરો, જેની અનુવર્ત્તી બાજુઓ $3/5$ ભાગની હોય.

રચનાના મુદ્દા :

સોપાન : 1 આપેલ ABC ની BC બાજુ સાથે, શિરોબિંદુ A ની વિરુદ્ધ દુશામાં લઘુકોણ બનાવતુ કિરણ BX દોરો.

સોપાન : 2 કિરણ BX પર પાંચ બિંદુઓ B_1, B_2, B_3, B_4 અને B_5 એવાં મેળવો કે જેથી $BB_1 = B_1B_2 = B_2B_3 = B_3B_4 = B_4B_5$ થાય.

સોપાન : 3 B_5C જોડો. B_3 માંથી B_5C ને સમાંતર રેખા દોરો જે BC ને કાપે ત્યાં C' નામ આપો.

સોપાન : 4 C' માંથી AC ને સમાંતર રેખા દોરો, જે AB ને કાપે ત્યાં A' નામ આપો.

આમ, $\Delta A'BC'$ એ માગ્યા મુજબનો ત્રિકોણ બનશે.

$$\text{એટલે કે } \frac{A'B}{AB} = \frac{BC'}{BC} = \frac{A'C'}{AC} = \frac{3}{5} \text{ થશે.}$$

રચના 11: 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુઓવાળો ત્રિકોણ દોરો. આ ત્રિકોણને સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ $\frac{2}{3}$ ભાગીની હોય.


મોડચુલ - 3

ભૂમિતી



નોંધ

રચનાઓ



આકૃતિ ૧૮.૧૧

રચનાના મુદ્દા :

સોપાન : 1 રેખાખંડ $BC = 7$ સેમી દોરો.

સોપાન : 2 B ને કેન્દ્ર લઈ 6 સેમીની ત્રિજ્યા વડે એક ચાપ દોરો અને C ને કેન્દ્ર લઈ 5 સેમીની ત્રિજ્યા વડે બીજું ચાપ દોરો. બંને ચાપના છેદબંધુને A નામ આપો.

સોપાન : 3 AB અને AC જોડીને ΔABC મેળવો.

સોપાન : 4 BC સાથે લઘુકોણ બનાવતું BX કિરણ દોરો, જે A ની વિરાસ્ત બાજુઓ હોય.

સોપાન : 5 BX કિરણ પર B_1, B_2 અને B_3 બંધુઓ મેળવો કે જેથી $BB_1 = B_1B_2 = B_2B_3$, થાય.

સોપાન : 6 B_3C જોડો. B_2 માંથી B_3C ને સમાંતર રેખા દોરો જે BC ને કાપે ત્યાં C' નામ આપો.

સોપાન : 7 C' માંથી CA ને સમાંતર રેખા દોરો, જે BA ને કાપે ત્યાં A' નામ આપો.

આમ, $\Delta A'BC'$ એ માર્ગ્યા મુજબનો ત્રિકોણ બનશે.

$$\text{એટલે કે } \frac{A'B}{AB} = \frac{BC'}{BC} = \frac{A'C'}{AC} = \frac{2}{3} \text{ થશે.}$$



તમારી પ્રગતિ ચકાસો 18.3

1. 4 સેમી, 5 સેમી અને 7 સેમી બાજુવાળો ત્રિકોણ દોરો. આ ત્રિકોણને સમરૂપ એવો બીજો ત્રિકોણ રચો જેની બાહુઓ મૂળ ત્રિકોણની અનુવત્તી બાજુઓના $\frac{3}{4}$ ભાગની હોય.,
2. $BC = 7$ સેમી, $AB = 5$ સેમી અને $\angle ABC = 60^\circ$ હોય એવો ΔABC દોરો. ΔABC ને સમરૂપ હોય એવો ત્રિકોણ રચો જેની બાજુઓ ΔABC . ની બાજુઓના $\frac{4}{5}$ ભાગની હોય.


મોડ્યુલ - 3

ભૂમિતી



નોંધ

રચનાઓ



આકૃતિ ૧૮.૧૨

3. એક કાટકોણ ત્રિકોણ દોરો જેની કાટખૂણો બનાવતી બાજુઓ 5 સેમી

અને 6 સેમી હોય. આ ત્રિકોણને સમકૃત ત્રિકોણ રચો જેની બાજુઓનું પ્રમાણમાપ $\frac{4}{5}$ હોય.

4. પાયો $BC = 6$ સેમી, $\angle ABC = 60^\circ$ અને $AB = 4.5$ સેમી હોય તેવો ΔABC દોરો. ΔABC ને સમકૃત $\Delta A'BC'$ આ જેમાં અનુવર્તી બાજુઓનું પ્રમાણમાપ $\frac{5}{6}$. હોય.

18.4 વર્તુળને સ્પર્શકોની રચના

રચના 12: આપેલ વર્તુળને તેની પરના બિંદુએ વર્તુળના કેન્દ્રનો ઉપયોગ કરીને સ્પર્ધક દોરવો.

ધારો કે C એ કેન્દ્ર O વાળું આપેલ વર્તુળ છે અને તેની પર P એક બિંદુ છે. તમારે વર્તુળને સ્પર્ધક દોરવાનો છે.


આપણે નીચેનાં સોપાન અનુસરીએ :

સોપાન 1 : OP જોડો.

સોપાન 2 : P આગળ, PT \perp OP દોરો.

સોપાન 3 : TP ને Q સુધી લંબાવો.

આમ, TPQ એ આવશ્યક સ્પર્ધક છે.



આકૃતિ ૧૮.૧૩

રચના 13 : વર્તુળને તેની બહારના આપેલ બિંદુમાંથી સ્પર્ધક દોરવા.

ધારો કે C આપેલ વર્તુળ છે અને A તેની બહાર બિંદુ છે. તમારે બિંદુ A માંથી વર્તુળને સ્પર્ધક દોરવાના છે, તે માટે આપણે નીચેનાં સોપાનો અનુસરીએ :

સોપાન 1 : OA જોડો

સોપાન 2 : OA નો કાટકોણ દ્વિભાજક દોરો. ધારો કે R એ OA મધ્યબિંદુ છે.

સોપાન 3 : R કેન્દ્ર અને RO જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, જે આપેલ વર્તુળોને P અને Q માં છેદે.

સોપાન 4 : AP અને AQ જોડો.

આમ, AP અને AQ આવશ્યક સ્પર્ધક છે.



નોંધ



તમારી પ્રગતિ ચકાસો 18.4

1. 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. વર્તુળ પર એક બિંદુ O લો. A આગળ વર્તુળના કેન્દ્રનો ઉપયોગ કરી વર્તુળને સ્પર્શક દોરો. વળી રચનાનાં સોપાનો લખો.
2. 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને બે સ્પર્શકો PQ અને PR દોરો. PQ અને PR ની લંબાઈ સમાન છે તે ચકાસો. વળી રચનાનાં સોપાનો લખો.



સત્ત્રાંત સ્વાધ્યાય

1. રેખાખંડ PQ = 8 સેમી લંબાઈનો દોરો. તેને આંતરિક રીતં ગુણોત્તર 3:5 માં વિભાગો. વળી રચનાનાં સોપાનો લખો.
નોંધ: તમારે નીચેના કૂટપ્રશ્નોમાં દરેકમાં રચનાનાં સોપાનો પણ લખવાનાં છે:
2. રેખાખંડ AB = 6 સેમી દોરો. AB પર એક બિંદુ C એવું શોધો કે AC : CB = 3 : 2 AC અને CB માપો.
3. 14 પરિમિતિ અને પાયા કોણ 60° અને 90° હોય, તેવો ત્રિકોણ રચો.
4. કાટકોણ ત્રિકોણ રચો જેનો કર્ણ 8 સેમી હોય અને તેની બીજી બાજુઓ પેકીની એક 5.5 સેમી હોય.
5. ΔABC રચો, જેમાં BC = 3.5 સેમી, AB + AC = 8 સેમી અને $\angle B = 60^\circ$.
6. ΔABC રચો, જેમાં AB = 4 સેમી $\angle A = 45^\circ$ અને AC - BC = 1 સેમી.
7. ΔPQR રચો, જેમાં PQ = 5 સેમી, PR = 5.5 સેમી અને પાયો QR = 6.5 સેમી હોય. ΔPQR ને સમરૂપ બીજો $P'Q'R'$ એવો રચો કે જેની અનુવત્તી બાજુઓ ΔPQR ની બાજુઓથી $\frac{5}{7}$ ગણી થાય.
8. 5 સેમી, 12 સેમી અને 13 સેમી બાજુઓવાળો કાટકોણ ત્રિકોણ દોરો. આ ત્રિકોણ સમરૂપ હોય એવો બીજો ત્રિકોણ રચો જેની અનુવત્તી બાજુઓ $\frac{5}{6}$ ગણી હોય.
9. 6 સેમી વ્યાસવાળું વર્તુળ દોરો. કેન્દ્રથી 6 સેમી દૂર આવેલા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને બે સ્પર્શકો દોરો.
10. AB = 8 સેમી દોરો. A ને કેન્દ્ર લઈ 4 સેમીની ત્રિજ્યા વડે એક વર્તુળ દોરો અને B ને કેન્દ્ર લઈ 3 સેમીની ત્રિજ્યા વડે બીજુ વર્તુળ દોરો. A થી બીજા વર્તુળને અને B થી પહેલા વર્તુળને સ્પર્શકો દોરો.